

# SHAH FOODS LIMITED

301, SARTHIK SQUARE, NR. SHAPATH – 3, S.G. HIGHWAY, BODAKDEV,  
AHMEDABAD – 380054, GUJARAT, INDIA

CIN L15419GJ1982PLC005071

Mail ID: [shahfoods.ahmedabad@gmail.com](mailto:shahfoods.ahmedabad@gmail.com), (M) 6355582651

TO,  
**ASSISTANT GENERAL MANAGER**  
LISTING & COMPLIANCE  
**BSE LIMITED**  
PHIROZE JEEJEEBHOY TOWERS  
DALAL STREET, MUMBAI 400 001.

Date: 30.01.2025

Scrip Code-519031

## **Sub: Financial results for the quarter ended 31.12.2024**

### **SUB: SUBMISSION OF COPIES OF NEWSPAPER ADVERTISEMENT PURSUANT TO REGULATION 47 OF THE SEBI (LODR) REGULATIONS, 2015**

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of Un-audited financial results of the Company for the quarter and year ended December 31, 2024 published in the following newspapers on Thursday, 30<sup>th</sup> January, 2025.

1. The Newslines (Gujarati)
2. Chanakya ni Pothi [English]

Kindly take it in your record.

Thanking you,

Yours sincerely,

**For SHAH FOODS LIMITED**

**HEMAKSHI**

**MANAN PATEL**

Digitally signed by  
HEMAKSHI MANAN PATEL  
Date: 2025.01.30 14:23:10  
+05'30'

HEMAKSHI MANAN PATEL (DIN 07297442)

**Managing Director**

# ધી જ્યુવલાઇબ

વર્ષ : ૩૧ અંક : ૧૨૯ તા.૩૦-૦૧-૨૦૨૫ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : પરેશ ગંજવાલા, સહ તંત્રી : રાધિકા ગંજવાલા

## ટોચની કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના આંકડા સદંતર નબળા

### ત્રીજા ક્વાર્ટર દરમ્યાન ટુ-સ્ટિલરની માંગમાં ભારોભાર નબળાઈ



ગણીગાંડી કંપનીઓના આંકડા વૃદ્ધિ જ હાંસલ મોત્સાહક આવ્યા છે બાકી મોટા ભાગની ટોચની કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના આંકડા સદંતર નબળા આવી રહ્યા છે. એચઆઈફસી બેંકનો નફો નાનો ઉછાળો દર્શાવે છે. પરંતુ તેનું મુખ્ય કારણ છે કે મેનેજમેન્ટે એનપીએની જોગવાઈમાં ઘટાડો કર્યો અને તે રીતે નફાને થોડોક ઉંચો બતાવ્યો અને તે જ પ્રકારનો નબળો ટ્રેન્ડ ગયા અહવાલિયા દરમ્યાન લિન્ડુસ્ટાન યુનિલિવરના શેરમાં પણ જોવાયું છે અને તેણે પણ ટોપવાઈન અને બોટમવાઈનમાં તદ્દન સામાન્ય જ મજબૂત છે.

### ગામની ગપસપ

- ઈન્ડોસ**, શુક્રવારે પણ ખુલતાની સાથે જ સેક્સેક્શનમાં ૨૫૦ પોઈન્ટનું ગાબડું અને નિફ્ટીએ ૨૩૨૫૦ નું લેવલ તોચું. અસંખ્ય મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં તીવ્ર ઘટાડો. અને ભારતીય રૂપિયામાં વધારે ઘસારો જોવા મળે તે ભય, ઈન્ડોસમાં સુધારો જોવા મળે તેવી આશા નહિવત.
- આયશર મોટર્સ**, ટિમિયમ બાઈડના વેચાણો હોવાને કારણે માંગ અંગે ગભરાટ નહિવત, નફો પણ સારો આવવાની ગણતરી અને તેથી ખરાબ બજારમાં પણ આ શેર થીમો સુધારો જાળવી રાખે તે આશાવાદ, ડા. ૫૧૧૧ના ભાવે બે કે પાંચેક શેર લઈને મૂકી દેવાય. ઉપરમાં ડા. ૫૨૫૨ અને તે પછી ડા. ૫૪૫૪નો ભાવ જોવા મળવાની ગણતરી.
- તાતા સ્ટ્રીટબુલ**, અન્ય એફએમસીજ કંપનીઓમાં અત્યારે ભારોભાર નિરાશા પરંતુ મીડાનું વેચાણ ઘટવાનું છે? તાતા કન્સ્યુમરની મજબૂત પોઝિશન, ડા. ૮૮૪ ઉપર આવ્યો અને આવતા થોડા દિવસો દરમ્યાન ધીરે ધીરે વધીને ડા. ૯૯૮ અને તે પછી ડા. ૧૦૧૧નો ભાવ જોવા મળી જવાની સંભાવના મજબૂત છે.
- રાઈલ્સ**, ડા. ૩૩૮૯વાળા આ શેરમાં પણ જોખમ નહિવત, સોનાના ભાવ સતત વધતા જાય છે અને તેને કારણે દાગીનાના બિઝનેસમાં વેચાણમુલ્ય અને નફાશક્તિ સુધરે. અત્યારના ખરાબ બજારમાં પણ થોડા ઘટાડો કરીને શેર ભેગા કરતા જવાય.
- વિપો**, આઈટી શેરોમાં અત્યારે એનાલિસ્ટોને વિપ્રો સૌથી વધારે સલામત લાગી રહ્યું છે. ડા. ૩૧૨૭વાળા આ શેરમાં ડોલરની મજબૂતીનો ફાયદો દેખાય. અને શેર ધીમા સુધારા સાથે ડા. ૩૩૦ અને તે પછીના ઉછાળે ડા. ૩૪૫ ઉપર આવી જવાની ગણતરી.
- એક્સિસ બેંક**, છેલ્લા થોડા દિવસોમાં ખૂબ જ મોટું કરેકશન જોવાયું. અત્યારના ડા. ૮૫૧વાળા આ શેરમાં હવે ઘટવાની જગ્યા નહિવત, થોડા થોડા કરીને શેર ભેગા કરતા જવાય.
- ઝી. કેડીટ લેન્ડોરેટરી**, ડોલર મજબૂત થઈ રહ્યો હોવાથી નિકાસ વેચાણોમાં ફાયદો મળે. તેમ છતાં આ શેરમાં અત્યારે નબળાઈનો તબક્કો, ડા. ૧૨૮૯ના લેવલથી ઘટીને આવતા થોડા દિવસો દરમ્યાન વધારે ઘટાડા સાથે ડા. ૧૨૭૪ અને તે પછી ડા. ૧૨૫૦ સુધી ઉતરી જવાની સંભાવના મજબૂત છે.
- હીરો મોટોકોર્પ**, ગ્રામ્ય ભારતના વેચાણો નબળા અને તેથી હીરો મોટોકોર્પને સૌથી વધારે અસર પડે. શેર અત્યારે ડા. ૪૧૦૦ ઉપર અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં વધારે મોટા ઘટાડા સાથે ડા. ૪૦૪૫ અને તે પછી ડા. ૩૯૯૦નો ભાવ જોવા મળી જવાની ગણતરી.
- એચડીએફસી બેંક**, દેખીતી રીતે નફો થોડોક વધ્યો છે, પરંતુ હવે અર્થતંત્રના સ્લોડાઉનને કારણે એનપીએ વધવાનો ભય, ક્રેડિટકાર્ડના બિઝનેસમાં ભલે ટોચનું નામ હોય પરંતુ તેમાં પણ એનપીએ બહાર આવવાની ગણતરી. ડા. ૧૬૬૪વાળા આ શેરમાં બીજા ડા. ૫૦ ક્યાં કપાઈ જશે તે પણ ખબર નહિ પડે.
- સ્ટેટ બેંક**, ખૂબ જ મોટા એનપીએની સંભાવના. પર્સનલ ચિરાણોમાં પણ અનસિકમ્પોઈટરણનો હિસ્સો મોટો અને તેને કારણે પણ નફાશક્તિને અસર પડવાની. અત્યારે ડા. ૭૪૫માં મળી રહેલા આ શેરમાં વધારે ઘટીને ડા. ૭૪૦ અને તે પછી ધીરે ધીરે ડા. ૭૨૦ સુધી ઉતરી જવાની ગણતરી.
- લાર્સન એન્ડ ટુલો**, પરદેશમાંના વિવિધ પ્રોજેક્ટોને અસર પડવાની, સેન્ટીમેન્ટ નબળું, ઘટીને ડા. ૩૫૦૩ ઉપર આવ્યો છે અને હજી પણ આ શેરમાં મોટા ઘટાડા સાથે ડા. ૩૪૬૬ અને તે પછી ડા. ૩૪૩૦નો ભાવ જોવા મળવાની ગણતરી.
- એનટીપીસી**, એનટીપીસી ગ્રીનના આઈપીઓ વખતે દોડાવ્યો હતો પરંતુ હવે આ શેર માટે દોડવાનું કોઈ કારણ નથી બચ્યું. અત્યારે ડા. ૩૨૩ ઉપર આવી ગયેલા આ શેરમાં આવતા થોડા દિવસો દરમ્યાન ભાવ વધારે ઘટીને ડા. ૩૧૭ અને તે પછી ડા. ૩૧૧ ઉપર આવી જવાની ગણતરી.
- લિન્ડુસ્ટાન યુનિલિવર**, વેચાણમાં માંડ માંડ થોડો સુધારો બતાવ્યો, પરંતુ લાંબો કસ નથી. પસિલામ ખરાબ આવે તે ભય વધતો જાય છે. વધારે ઘટાડા સાથે ડા. ૨૨૬૨ અને તે પછી ડા. ૨૨૨૨નો ભાવ જોવા મળવાની ગણતરી.

સામે પક્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન શેરબજારમાં પણ નબળાઈનો તબક્કો જોવાયો. ગયા અઠવાડિયે અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા અને તે પછી તેમણે ડેલ્ટાક એક્ઝ્યુટીવ ઓર્કિસી સહી કર્યા છે અને તેમાં અમેરિકામાં જે રીતે જન્મથી નાગરિકતાનો હક મળતો હતો તેને હવે બંધ કરી દેવાયો છે. અને આ ઉપરાંત હવે ૧લી ફેબ્રુઆરીથી વિવિધ દેશો ઉપર આયાત ટેરિક લગાવાશે તે સંભાવના મજબૂત છે. અમેરિકન પ્રમુખના સુચન સામે ભારતમાં તો ૧૮૦૦૦ નાગરિકોને પાછા બોલાવી લેવા સહમતી થઈ ગઈ છે તેમ છતાં આગામી દિવસોમાં જે રીતે રશિયામાંથી સસ્તુ ફૂડ ખરીદવામાં આવતું હતું તેની ઉપર અંકુશ આવી જતા ભારતમાં ફૂડની આયાત માંથી થઈ જશે. એમ પણ ડોલરની સામે રૂપિયો સતત ઘસાઈ રહ્યો છે અને બીજી તરફ રશિયામાંથી સસ્તુ તેલ આવતું બંધ થતા તેને કારણે ભારતની ફૂડની પડતર અતિશય માંધી થઈ જશે અને પેટ્રોલ અને ડોલરના ભાવમાં આગામી દિવસોમાં તોતિંગ ઉછાળો જોવા મળે તેવી ગણતરી છે. અને તેની સીધી અસર તમામ ચીજવસ્તુઓ અને ટ્રાન્સ્પોર્ટેશન ખર્ચ ઉપર પડશે. આમ આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર માંઘવારી અને ફુંગાવાના ચક્કરમાં ફસાયેલું રહે તે સંભાવના મજબૂત છે. આગાઉ અનેક વખત દર્શાવ્યું છે કે રૂપિયો નબળો પડે એટલે વિદેશી રોકાણકારોએ ભારતમાં રોકાણ કરવું બિનઆકર્ષક બની જાય અને પ-ઈ રિટર્ન કમાવાની લાલચમાં તેમની મૂડીમાં જ મોટું શોવાણ થતું હોય છે અને આ પાસાની અસર આગામી દિવસોમાં એફઆઈઆઈની વેચવાલી મારફતે દેખાવે તેમ સ્પષ્ટ રીતે કહી શકાય. અને તેથી કંપનીઓના થોડા ઘસારા પરિણામો વચ્ચે પણ નિફટી અને બેંક નિફટીમાં તેમજ ટોચની કંપનીઓ રિલાયન્સ, ટીસીએસ, એચઆઈફસી બેંક વગેરે શેરોમાં ઘટાડો આગળ વધે તે સંભાવના ખૂબ મજબૂત છે.

રીયલ એસ્ટેટ સેક્ટરમાં મુશ્કેલીએ અંગે અમે ઘસારા અંકથી દર્શાવીએ છીએ અને જે રીતે રિયલ એસ્ટેટ ઈન્ડેક્સ ૧૦ મહિનાના બોટમ ઉપર આવી ગયો છે તે આ ભાવતનો સ્પષ્ટ પુરાવો છે. અને આગામી દિવસોમાં રીયલ એસ્ટેટ કંપનીઓમાં નફાશક્તિ સમાચારો શરૂ થાય તે સંભાવના ખૂબ મજબૂત છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં તહેવારોની સિઝન દરમ્યાન પણ વેચાણો ખાસ ન જોવાયા. અને અત્યારે પણ વેચાણો એકદમ ઠંડા ચાલી રહ્યા છે પરંતુ મુખ્ય ખરાબી એફએમસીજ અને કન્સ્યુમર સેક્ટર સાથે કહી શકાય. માંઘવારી કાલિલ હોવાને કારણે તમામ નાના-મોટા ગ્રાહકોએ પોતાના ખર્ચા કાપવાનું શરૂ કર્યું છે. અને હજી તે વ્યાજદર ઘટશે એટલે ફિક્સ રિપોઝીટોના વ્યાજ પણ ઘટવાના અને તેથી આવક ઘટશે અને બીજી તરફ ખર્ચા વધતા હશે અને આ પાસાની અસર પણ ગ્રાહકમાં ઉપર ખૂબ જ નફાશક્તિ પડે તે સંભાવના ખૂબ મોટી છે. સામે પક્ષે બેંક એફ જાણને તેના વ્યાજદરમાં ૨૫ બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે અને તે રીતે જાપાનમાં અત્યારે સને ૨૦૦૮ પછી બેંક વ્યાજદર સૌથી ઊંચા લેવલે પહોંચી ગયો છે. સામે પક્ષે અમેરિકામાં વ્યાજદર તાત્કાલિક ઘટાડવામાં આવે તેનું સુચન ફેડરલ રિઝર્વને કરવામાં આવ્યું છે અને હવેની મીટિંગમાં ફેડરલ રિઝર્વ દ્વારા તે અંગે શું પ્રતિભાવ આપવામાં આવે તે જોવું રહ્યું. અને હવે ભારતમાં પણ વ્યાજદરમાં ઘટાડો આવે તે સંભાવના ખૂબ મોટી છે. સામે પક્ષે સિંગાપોરમાં પણ સને ૨૦૨૦ પછી પ્રથમ વખત મોનેટરી

પોલીસીમાં હળવો ટ્રેન્ડ અપનાવાયો છે અને સિંગાપોરની સેન્ટ્રલ બેંકે વૃદ્ધિદર ધીમો પડી રહ્યો હોવાનું દર્શાવ્યું છે. આમ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં નબળાઈ ચાલુ રહેશે તેવી ગણતરી છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયાળના દરમ્યાન ઓટોમોબાઈલ ઉત્પાદકો દ્વારા કેવળ ૬ ટકા વોલ્યુમ વૃદ્ધિદર હાંસલ થયો છે અને તે પણ તહેવારોની સિઝન હોવા છતાં. જ્યારે ત્રીજા ક્વાર્ટર દરમ્યાન ટુ-સ્ટિલરની માંગમાં ભારોભાર નબળાઈ જોવા મળી. પેસેન્જર વાહનોમાં એકંદરે માંગ થોડીક સંતોષકારક હતી અને ટ્રેકટરની માંગ પણ થોડીક વધી છે. પરંતુ સામે પક્ષે કોમર્શિયલ વાહનોની માંગમાં ઘટાડો જોવાયો છે. જ્યારે તે સંભાવના જોવાય છે. અને તે પાછળ ડુંડઈ મોટરનો શેર અત્યારે ડા. ૧૭૦૫ ઉપર આવી ગયો છે અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં વધારે તીવ્ર ઘટાડા સાથે ડા. ૧૬૯૦ અને તે પછી ડા. ૧૬૫૦ સુધી ભાવ ઉતરી જવાની સંભાવના છે. ગ્રામ્ય લેલેન્ડમાં વેચાણોમાં લગભગ ૨.૪ ટકાનો ઘટાડો જોવા મળે પરંતુ તેનો નેટનફો પણ લગભગ ૮ ટકા વધે તેવી ગણતરી છે અને તે પાછળ અશોક લેલેન્ડનો શેર આગામી દિવસોમાં વધારે તૂટે તેવી ગણતરી છે. ડા. ૨૬૫ના ટોપથી ઘટીને અશોક લેલેન્ડનો શેર અત્યારે ડા. ૨૦૭ ઉપર તો આવી ગયો છે અને આવતા થોડા દિવસોમાં વધારે કરેકશન સાથે ડા. ૨૦૧ અને તે પછી ડા. ૧૯૯નો ભાવ જોવા મળવાની સંભાવના છે. ટુ-સ્ટિલર કંપનીઓમાં ટીવીએસ મોટર્સના વેચાણોમાં લગભગ ૧૦.૪ ટકાનો પરંતુ તેના નેટનફામાં ૯.૫ ટકાનો ઉછાળો જોવા મળે તે સંભાવના મજબૂત છે. ટીવીએસ મોટર્સનો શેર અત્યારે ડા. ૨૩૦૦ ઉપર છે અને આ શેરમાં પણ આગામી દિવસોમાં વધારે કરેકશન જોવા મળવાની ગણતરી છે. આગામી દિવસોમાં આ શેરમાં ડા. ૨૨૬૩ અને તે પછીના ઘટાડો ડા. ૨૨૨૩ સુધી ભાવ આવી જાય તો નવાઈ નહિ લાગે. બજાજ ઓટોના વેચાણોમાં લગભગ ૭.૫ ટકા અને તેના ડિસેમ્બર ક્વાર્ટરમાં લગભગ ૬ ટકાનો ઉછાળો જોવા મળવાની સંભાવના છે, પરંતુ સામે પક્ષે બજાજ ઓટોનો શેર સ્પષ્ટ રીતે મંદીમાં ચાલે છે. ડા. ૧૨૭૭ના ટોપથી ઘટીને બજાજ ઓટોનો શેર અત્યારે ડા. ૮૩૯૯ ઉપર આવી ગયો છે અને આ શેરમાં આવતા થોડા દિવસોમાં ડા. ૮૩૫૦ અને તે પછીના ઘટાડો ડા. ૮૨૨૯ સુધી ભાવ ઉતરી જવાની સંભાવના મજબૂત છે.

**હીરો મોટોકોર્પ** અત્યારે ડા. ૪૧૦૦ ઉપર ચાલે છે અને હીરો મોટોકોર્પના વેચાણોમાં લગભગ ૪.૨ ટકાનો ઉછાળો જોવા મળવાની ગણતરી છે, પરંતુ તેનો નેટનફો લગભગ પાંચેક ટકા નીચો આવે તે ભય છે. હીરો મોટોકોર્પમાં પણ છેલ્લા થોડા દિવસોથી કરેકશન આગળ વધતું જાય છે. ડા. ૬૨૪ના ટોપથી લગભગ ૩૩ ટકા ઘટીને અત્યારે ડા. ૪૧૦૦ ઉપર આવી ગયેલા આ શેરમાં આવતા થોડા દિવસોમાં ડા. ૪૦૪૫ અને તે પછીના ઘટાડો ડા. ૩૯૯૦ સુધી ભાવ ઉતરી જવાની સંભાવના મજબૂત છે. **આયશર મોટર્સ**માં પણ વેચાણ વૃદ્ધિ સુંદર આવવાની ગણતરી છે. આયશર મોટર્સના વેચાણોમાં લગભગ ૨૦ ટકા ઉછાળો જોવા મળે તેવી અપેક્ષા છે. જ્યારે તેનો નેટનફો લગભગ ૧૨ ટકા સુધરે તેવી ગણતરી છે. આયશર મોટર્સનો શેર અત્યારે ડા. ૫૧૧૬ ઉપર ચાલે છે અને તેમાં પણ આવતા થોડા દિવસોમાં ધીરે ધીરે ભાવ ઊંચકાતો જવાની ગણતરી છે. ઉપરમાં ડા. ૫૧૯૦ અને તે પછીના ઉછાળે ડા. ૫૨૬૪ અને તે પછી ધીરે ધીરે ડા. ૫૪૪૪નો ભાવ જોવા મળવાની ગણતરી. **એસ્કોઈ કુબોટોના** વેચાણોમાં ૩૪ ટકા ઉછાળો જોવા મળે અને તેનો નેટનફો ૧૩ ટકા વધે તેવી ગણતરી છે. એસ્કોઈનો શેર અત્યારે ડા. ૩૫૮૮ ઉપર ચાલે છે અને તેમાં નાની રેન્જમાં જ ભાવ વધતો બતાવ્યા કરે તે સંભાવના ખૂબ મોટી છે. રાજકોટની **ચતુલ ઓટો**નો શેર અત્યારે ડા. ૫૧૬ ઉપર આવી ગયો છે અને આ શેરમાં હજી મોટા કરેકશનની જગ્યા બાકી છે. આવતા થોડા દિવસોમાં વધારે ઘટીને ડા. ૫૧૨ અને તે પછી ડા. ૫૦૮ અને તે પછીના ઘટાડો ડા. ૪૯૮ સુધી ભાવ ઉતરી જવાની સંભાવના મજબૂત છે. જ્યારે **ફોર્સ મોટર્સ** અત્યારે ડા.

દિવસોમાં મોટો ઘટાડો જોવા મળે તે ભય મર્યાદિત છે. આ શેર સારો એવો ઘટ્યો છે અને હવે એમઆરએફના શેરમાં મોટો ઘટાડો આવે તે ભય નથી લાગતો. **જે.કે. ટાયર**નો શેર અત્યારે ડા. ૩૪૯ ઉપર આવ્યો છે અને હજી પણ આ શેરમાં ભાવ વધારે ઘટીને ડા. ૩૪૦ અને તે પછીના ઘટાડો ડા. ૩૩૦ ઉપર આવી જવાની ગણતરી છે. હાલના તબક્કે આ શેરમાં રોકાણ વધારવાની ઉતાવળ ન કરાય. **ટીવીએસ સીયકનો** શેર અત્યારે ડા. ૩૦૪૭ ઉપર છે અને આ શેરમાં પણ આવતા થોડા દિવસો ઘટાડો જોવા મળવાની ગણતરી. એમ તો સારો એવો તૂટી ગયો હોવાથી આ કડીન્ટર ઉપર મોટો ઘટાડો નથી દેખાતો. **બાલકિષ્ણ ઇન્ડસ્ટ્રી**ના વેચાણો ઉપર યૂરોપિયન અર્થતંત્રની મંદીની અસર શરૂ થઈ ગઈ છે. કંપની યૂરોપિયન ઉપખંડમાં જંગી વેચાણો ધરાવે છે અને યૂરોપ અત્યારે ભારે સ્લોડાઉનમાં ફસાયું હોવાથી કંપનીની નિકાસોને અસર થવાનો ભય છે. ડા. ૨૭૨૮વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં હજી વધારે ઘટીને ડા. ૨૬૧૬ અને તે પછીના ઘટાડો ડા. ૨૫૧૫ સુધી ભાવ ઉતરી જાય તે સંભાવના મજબૂત છે અને તેથી હાલના તબક્કે આ શેરમાં એક્સપોઝર વધારવાની ઉતાવળ ન કરવી. **એન્જિન શેરો**માં પણ અત્યારે તીવ્ર કરેકશન શરૂ થઈ ગયું છે. **કમીલ્સ ઇન્ડિયા**નો શેર ડા. ૪૧૭૧ના ટોપથી ઘટીને ડા. ૨૮૮૯ ઉપર આવી ગયો છે અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં હવે નાના ઘટાડા સાથે ડા. ૨૮૪૮ અને તે પછી એક તબક્કે ડા. ૨૮૦૮ સુધી ભાવ જાય તેવી ગણતરી છે. કમીલ્સમાં તે પછી વધારે ઘટાડાની જગ્યા નથી દેખાતી. **સ્વશર એન્જિન** અત્યારે ડા. ૩૧૨૮ ઉપર ચાલે છે. અને આ શેરમાં છેલ્લા થોડા દિવસો દરમ્યાન ધીરે ધીરે સુધારો જોવાયો અને હજી પણ આ શેરમાં અટુટા આગળ વધે તેવી ગણતરી છે. પાંચેક શેરનું જોખમ લઈ શકાય. **ગીલ્સ કોટનો** શેર અત્યારે ડા. ૨૪૮ ઉપર છે અને આ શેરમાં પણ આગામી દિવસોમાં ધીરે ધીરે ભાવ સુધરતો જવાની ગણતરી છે. ઉપરમાં ડા. ૨૫૫ અને તે પછીના ઉછાળે ડા. ૨૬૫નો ભાવ જોવા મળે તે સહેજ પણ નવાઈ નહિ લાગે. **એક્સાઈલ ઇન્ડસ્ટ્રી** અત્યારે ડા. ૩૮૩ ઉપર છે. અને આ શેરમાં પણ આવતા થોડા દિવસોમાં ખૂબ જ મોટું કરેકશન જોવા મળવાની ગણતરી છે. કંપનીના વેચાણોમાં લગભગ ૧૨ ટકા ઓટોમોબાઈલ સેક્ટરની માંગ ઠંડી છે



અત્યારે ડા. ૨૯૪૭ ઉપર ચાલે છે અને આ શેરમાં બેન્ચાર સેશન સુધારો જોવાયો પછી નવું કરેકશન શરૂ થવાની ગણતરી છે અને તેથી તેમાં પણ નવું રોકાણ વધારવાની ઉતાવળ ન કરાય. **એમઆરએફ**માં વેચાણોમાં લગભગ ૧૩ ટકા ઉછાળો જોવા મળે પરંતુ તેના નેટનફામાં ૧૯ ટકા ઘટાડો જોવા મળે તેવો ભય છે. એમઆરએફનો શેર અત્યારે ડા. ૧૧૧૭૭૦ ઉપર આવી ગયો છે. આ શેરમાં ડા. ૧૧૧૪૪૫નું ટોપ બન્યું હતું અને આ પાસાને કારણે આગામી

SHAH FOODS LIMITED							
CIN : L15419 GJ 1982 PLC 005071 Regd. Office : Kalol Mehnsana Highway, PO-Chhatral, Tal.-Kalol, Dist.-Gandhinagar-382729 Telephone 079 26448371   02764233931 email : shahfoods.ahmedabad@gmail.com Statement of Standalone Unaudited Financial Results for the Quarter Ended 31.12.2024 (Rs. in lakhs)							
SR No.	PARTICULARS	Three Months ended			Nine Months		Year Ended
		31.12.2024 Unaudited	30.09.2024 Unaudited	31.12.2023 Unaudited	31.12.2024 Unaudited	31.12.2023 Unaudited	31.03.2024 Audited
1	Total Income From Operations (net)	52.03	88.59	0.02	148.62	0.05	0.07
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(2.05)	2.55	(2.43)	(6.43)	(12.82)	(21.91)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(2.05)	2.55	(2.43)	(6.43)	(12.82)	(21.91)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(2.05)	2.55	(2.43)	(6.43)	(12.82)	(21.91)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/Loss for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(2.05)	2.55	(2.43)	(6.43)	(12.82)	(21.91)
6	Equity Share Capital.(face value of Rs.10 each)	59.75	59.75	59.75	59.75	59.75	59.75
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous				(151.75)	(117.89)	(145.32)
8	Earning Per Share (before extraordinary items) of Rs.10 /- each	(0.34)	0.43	(0.41)	(1.08)	(2.15)	(3.67)
9	Earning Per Share (after extraordinary items) of Rs.10 /- each	(0.34)	0.43	(0.41)	(1.08)	(2.15)	(3.67)
<b>Notes :</b> 1.The above Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 28th January, 2025. The statutory auditors have carried out a limited review of the results for the quarter ended December 31, 2024 and have expressed an unqualified audit opinion. 2. The figures for the previous period/year have been regrouped /reclassified, wherever necessary. 3. This Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind As), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable. 4. The Disclosure is as per Regulation 33 of SEBI (Listing Obligations & Discloser Requirements) Regulations, 2015. 5. The Company is operating in single segment, so above results are for single segment only.							
<b>For and on behalf of the Board of Directors</b> <b>For, Shah Foods Limited</b> Sd/- <b>HEMAKSHI MANAN PATEL</b> Director DIN : 07297442							
Place : Ahmedabad Date : 28-01-2025							

## Quick commerce unicorn Zepto completes reverse flip from Singapore to India

Quick commerce unicorn Zepto has reverse-merged from Singapore to India ahead of its planned initial public offering (IPO), the company's chief financial officer, Ramesh Bafna, shared on social media.

Sharing the update, Zepto co-founder and chief executive officer, Aadit Palicha, said the company has received formal approval from Singaporean courts and the National Company Law Tribunal (NCLT) to complete its cross-border merger and become an Indian parent entity.

earlier green-lit by the NCLT. In an order dated January 9, NCLT said:

"The board of directors of the petitioner company believes that the scheme is in the best interests of the entity and their respective stakeholders, including its shareholders, employees, and creditors."

"Along with other top Indian startups, this is a historic milestone for the Indian startup ecosystem and an inflection point that represents long-term confidence in the liquidity and depth of Indian capital markets. The ecosystem is now building in India for the benefit of Indian shareholders," Palicha wrote.

Zepto's plan to shift its domicile back to India was

The NCLT gave its nod to Kiranakart Technologies Private Limited, the Indian entity operating Zepto, to become the holding company of the quick commerce firm. Zepto was earlier a subsidiary of KiranaKart Pte Ltd in Singapore.

Zepto plans to go public in the second half of 2025.

"This is a display of understanding of technicals, working with the right partners, getting into the nuts and bolts of execution, unblocking natural causes of delay, and making tactical calls in real time by an empowered team," Bafna shared.

He described the development as "historic," adding that the reverse-merging process was completed in the "fastest-ever" time.

## Adani Group gets CCI clearance to acquire majority stake in ITD Cementation

The Competition Commission of India on Tuesday approved Adani Group's arm Renew Exim DMCC's proposal to acquire a majority stake in ITD Cementation India for about Rs 5,757 crore.

ITD Cementation India Ltd is an engineering and construction company undertaking heavy civil, infrastructure and engineering, procurement and construction (EPC) business and operating in India and overseas.

"The proposed combination involves the acquisition by Renew Exim DMCC (acquirer) of approximately 46.64 per cent equivalent to 8,01,13,180 shares of the total issued and voting equity share capital of the ITD Cementation India Ltd (target)," the Competition Commission of India (CCI) said in a release.

Renew Exim DMCC is incorporated in Dubai, United Arab Emirates, and belongs to the Adani group. It is a holding

company engaged in the business of investment in commercial enterprises and management and does not have any operations in India.

Pursuant to the Sebi's SAST (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, Renew Exim DMCC has launched an open offer for further acquisition of up to 4,46,64,772 fully paid-up equity shares having a face value of Re 1 each, representing approximately 26 per cent of the voting share capital of the ITD Cementation India, the regulator added.

In total, Renew Exim DMCC will acquire a 72.64 stake in ITD Cementation India. In October 2024, Renew Exim DMCC announced it had entered into an agreement to acquire a 46.64 per cent stake in ITD Cementation India from its promoters for Rs 3,204 crore.

The acquisition also comes with an open offer by Renew Exim to acquire an additional 26 per cent stake in an engineering

and construction firm from public shareholders for Rs 2,553 crore, if fully subscribed.

The Adani Group expanded its cement business rapidly through a series of acquisitions. In 2022, it acquired Holcim's Indian assets, which made the conglomerate the country's second-largest cement producer. In June 2024, Adani announced the acquisition of Hyderabad-based Penna Cement at an enterprise value of Rs 10,422 crore.

Thereafter, the country's second-largest cement manufacturer in October announced that it would acquire CK Birla group firm Orient Cement at a valuation of Rs 8,100 crore as part of its expansion drive.

The group's expansion in the industry sparked fierce competition with billionaire Kumar Mangalam Birla, whose UltraTech Cement is the market leader with an annual production capacity of more than 150 million tonnes.

## Cipla Q3 result: PAT soars 48.7% to Rs 1,570.5 cr , revenue grows 7.1%

India's third largest pharma company Cipla posted a 48.7 per cent year-on-year (Y-o-Y) growth in its consolidated profit after tax (PAT) at Rs 1,570.5 crore for Q3FY25, while revenue from operations during the period grew by 7.1 per cent to Rs 7,073 crore.

The increase in the net profit can be attributed to good performance in the domestic market, product mix and operation efficiencies.

Sequentially, revenue from operations grew by 0.3 per cent, whereas PAT grew by 20.6 per cent. The firm's stock rose by 2.16 per cent to 1,426.1 apiece on the BSE. The results came during market hours on Tuesday.

The firm's earnings before interest, tax, depreciation, and amortization (Ebitda) rose by 14.4 per cent year-on-year (Y-o-Y), reaching Rs 2,210.5 crore.

Profit exceeded Bloomberg estimates by 0.26 per cent, whereas the revenue fell along the expected lines.

Commenting on the result, Umang Vohra, MD and Global CEO, Cipla said, "In Q3FY25, we delivered growth across all our various geographies, despite a supply challenge in the US. We recorded our highest-ever Ebitda margin of 28.1 per cent, driven by mix and other operational efficiencies. Our One-India business grew at a healthy 10 per cent YoY."

On the US policy changes, Vohra said, "It's still early to predict the direction of economic policy under the new administration, especially with regards to decisions like tariffs. While there have been some statements of intent, we will

need to wait and see how that plays out. However, looking at the past three years, we've made significant investments, including nearly \$100 million to establish two inhaler plants in the US, alongside a strong and large capacity solid dosage plant. We've worked to de-risk and diversify our business model during this period."

The company said it is closely monitoring the US administration's policy changes, but remains confident that its diversified business model and investments in facilities like inhaler plants and oral solid dosage units will provide resilience. The company also revealed that the impact of the President's Emergency Plan for AIDS Relief (PEPFAR) programme which has supported HIV/AIDS medicines on Cipla's business is minimal, contributing less than \$5 million in sales with low margins. Cipla said it is not a significant contributor to its margins and will have minimal impact on its overall business performance. Donald Trump administration has already instructed organisations in other countries to stop disbursing HIV medications purchased with US aid.

Meanwhile, Cipla also plans to offset the impact of the Revlimid patent expiry in 2026 through new product launches.

Going ahead, the company's focus will be on growing its key markets, further building its flagship brands, investing in future pipelines as well as focusing on resolutions on the regulatory front.

Chronic therapies, which include respiratory, cardiology, diabetes etc, remain key growth drivers and anti-infective and

mass-market divisions are also projected to contribute to future growth.

Speaking on this year's guidance, Vohra said, "Firstly, we're confident that we'll end the year exceeding the guidance range we've previously set. With a quarter still remaining, we won't be revising our guidance, but it's clear that we'll surpass the original expectations."

In India, the branded prescription business saw growth in key therapies such as respiratory, urology, and acute care, despite seasonal challenges in the acute segment. The trade generics division returned to a growth trajectory after facing challenges in recent quarters, driven by strong execution in key therapies, new product introductions, and technological advancements.

Cipla's consumer health portfolio continued its robust performance, with flagship brands Nicotex, Omigel, and Cipladine maintaining leadership in their respective categories.

North America delivered quarterly revenue of \$226 million, supported by strong momentum in differentiated assets. The company also secured multiple generic drug approvals, including Phytonadione Injectable, Esomeprazole Granules, and Potassium Phosphates Injection.

Cipla has resolved most supply chain issues for Lanreotide, which is used to treat gastroenteropancreatic neuroendocrine tumors and expects normalisation in Q1FY26.

during the same period in FY24. HMIL sold 186,408 passenger vehicles during the quarter, down 2 per cent from 190,979 units sold in the same period last financial year. This includes 146,022 units in the domestic market, driven by a strong contribution from the sport utility vehicle segment.

The company achieved its highest-ever compressed natural gas penetration during the quarter, reaching 15 per

gains of around Rs 30 crore during the quarter. Despite the challenges, Hyundai expressed confidence in improving its volume and profitability, backed by strong fundamentals.

"While challenges persist in the overall market due to global factors, our business fundamentals remain strong. We are confident in our ability to leverage our strengths and actively explore opportunities to enhance our volumes and

profitability," said Unsoo Kim, managing director of HMIL.

HMIL remains optimistic about growing EV penetration in India and is committed to

electrification with a holistic approach. The company believes the Creta Electric will drive phenomenal success, build strong momentum, and be a game changer in the EV landscape. It is also building a robust EV ecosystem in India, including localisation and charging infrastructure, and plans to launch three additional EVs in the near future.

"In the mid-to-long term, we believe we can achieve a 20 per cent market share. The Creta Electric will be a critical product that helps us secure additional volumes in 2025 and beyond," Garg added.

Although volumes declined during the quarter, the company expects demand to pick up and projects low single-digit growth in the fourth quarter.

Tarun Garg, whole-time director and chief operating officer, said the company is aiming for a 20 per cent market share in the electric vehicle (EV) sector in the mid-to-long term, with the newly launched Creta Electric expected to play a pivotal role. The company is also focusing on building an EV ecosystem while exploring alternative technologies such as hydrogen, hybrid, and flexible fuel.

In Q3FY25, the company's revenue declined marginally by 1 per cent to Rs 16,648 crore, compared to Rs 16,875 crore

## Bajaj Auto Q3 FY25 results: Net profit rises 8% to Rs 2,196 crore

Pune-based Bajaj Auto, which recently forayed into CNG bikes and made the Chetak the bestselling electric scooter in December, posted an 8 per cent year-on-year (Y-o-Y) rise in consolidated profit after tax (PAT) for the third quarter of the current financial year (Q3FY25) to Rs 2,196 crore while its revenues grew by 8.2 per cent to Rs 13,169 crore.

The Ebitda (earnings before interest, taxes, depreciation and amortisation) margin remained steady at 20.2 per cent — fifth consecutive quarter of over 20 per cent Ebitda margin — as favourable US dollar-INR realisation and judicious pricing and cost efficiencies offset the significant investments Bajaj Auto made on strategic priorities.

The impact of currency fluctuations (rupee depreciation) on Ebitda was around 0.5 per cent (positive) in Q3FY25, a senior company official said.

Sequentially, profits grew by 58.5 per cent even as revenues dipped marginally.

The company said it had the highest-ever festive retail volumes in the domestic market, although billed volumes were recalibrated to normalise channel inventory that was built up between previous quarter and this. Exports saw a broadbased recovery that led to the return of over 500,000 units after nine quarters.

Speaking to reporters, Rakesh Sharma, executive director, Bajaj Auto, said that export revenues have grown by 16 per cent in Q3FY25 to Rs 4,500 crore. Going forward they expect exports growth to remain strong (over 20 per cent) in the near-term as they are positive on growth from the Latin American markets.

On the domestic front, Bajaj Auto's focus on green energy has started to pay off. The green energy portfolio now contributes around 45 per cent of revenues (up from 30 per cent last year) as it delivered around 100,000 units of both two-wheelers and three-

wheelers in the quarter. It has grown market share in both electric two-wheelers (e2Ws) and electric three-wheelers (e3Ws). The company's Q3FY25 exit market share in e2Ws was 25 per cent, up 11 per cent Y-o-Y, and in e3Ws it was up to 35 per cent from 13 per cent.

Sharma said that the margin profile of Chetak has improved and with the new 35-series, Bajaj Auto has now gone out of the red zone into profitable growth. Chetak is already the leader in the sub-Rs 1 lakh segment (2903 series), and now with the 35-series, it aims to gain share in the above-Rs 1 lakh segment where it has single-digit market share. Bajaj will launch a couple of more variants in the Chetak portfolio in the next two-three months.

Also, the over-125cc motorcycles delivered the highest-ever quarterly volumes in retail and Sharma said that he expects the overall motorcycle industry to clock 6-8 per cent growth over the next 6-8 months. In the first half of the current financial year (H1FY25), industry growth was around 6 per cent and during the festive season, it went up to 11-13 per cent. Overall industry growth has been around 8 per cent for the first nine months of the financial year (9MFY25), Sharma said. "The 125cc and above segment is growing at double the rate of the 100cc segment, and we expect to outpace industry growth in the top end of the bikes segment," he reasoned.

As for the new CNG bike Freedom, Sharma said that they have sold 50,000 units in five months. In October, the sales had gone up to 16,000 units.

e3Ws to have new umbrella brand 'Gogo'

Bajaj Auto will launch a new brand identity, Gogo, for its e3Ws in both cargo and passenger segments. "We will launch another variant in a month and we are also planning to increase market share in this segment. We already grew from 13 per cent in Q3 last year to 35 per cent now," said Sharma.

## Sebi rejects Digvijay Gaekwad's plea for Religare Enterprises open offer

The Securities and Exchange Board of India (Sebi) on Tuesday returned a letter by the Florida-based entrepreneur Digvijay 'Danny' Gaekwad seeking permission to make a "competing open offer" for equity shares of Religare Enterprises (REL).

In a disclosure made to the exchanges, the financial services firm shared the letter sent by Sebi in response to Gaekwad's proposal seeking permission to acquire 55 per cent of REL at Rs 275 per share.

"The letters submitted by Digvijay Laxmansinh Gaekwad are being returned since the same is not an exemption application in terms of Regulation 11 of Sebi (SAST) Regulations, 2011," said the market regulator.

Sources said Gaekwad's

offer did not stand ground with Sebi as it failed to come within the stipulated timeline and didn't follow the right process of appointing investment bankers.

Gaekwad made the competing offer at a 17 per cent premium against the Dabur promoter Burman family. The letter by Gaekwad stated that the Burmans' open offer price of Rs 235 per equity share "grossly undervalues" the real worth of REL, and is to the detriment of public shareholders.

Earlier, independent directors of REL had also urged shareholders to take into account the low offer price by the Burman family. Legal players said Gaekwad would still have the option to approach the Securities Appellate Tribunal (SAT) to challenge Sebi's decision.

## Hyundai Q3 results: Net profit falls 19% to Rs 1,161 crore on demand dip

India's second-largest carmaker, Hyundai Motor India (HMIL), posted a 19 per cent decline in consolidated net profit for the October-December quarter (Q3) of 2024-25 (FY25), at Rs 1,161 crore, compared to Rs 1,425 crore during the same period in 2023-24 (FY24). The drop in net profit was primarily due to subdued domestic demand and the impact of geopolitical factors in export markets.



compared to 12 per cent in Q3FY24. It recorded robust growth in rural penetration, rising to 21.2 per cent from 19.7 per cent in the same period last year.

Export volumes stood at 40,386 units, an 8 per cent decline from 43,650 units. Garg said that exports were impacted by the Red Sea crisis and geopolitical issues in Latin America. However, Hyundai mitigated these challenges by expanding into new markets, including Africa and other emerging regions. The rupee's depreciation against the dollar resulted in foreign exchange

profitability," said Unsoo Kim, managing director of HMIL.

HMIL remains optimistic about growing EV penetration in India and is committed to

SHAH FOODS LIMITED							
CIN : L15419 GJ 1982 PLC 005071							
Regd. Office : Kalol Mehsana Highway, PO- Chhatral, Tal.-Kalol, Dist.-Gandhinagar-382729							
Telephone 079 26448371 , 02764233931 email : shahfoods.ahmedabad@gmail.com							
Statement of Standalone Unaudited Financial Results for the Quarter Ended 31.12.2024							
(Rs. in lakhs)							
SR No.	PARTICULARS	Three Months ended			Nine Months		Year Ended 31.03.2024 Audited
		31.12.2024 Unaudited	30.09.2024 Unaudited	31.12.2023 Unaudited	31.12.2024 Unaudited	31.12.2023 Unaudited	
1	Total Income From Operations (net)	52.03	88.59	0.02	148.62	0.05	0.07
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(2.05)	2.55	(2.43)	(6.43)	(12.82)	(21.91)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(2.05)	2.55	(2.43)	(6.43)	(12.82)	(21.91)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(2.05)	2.55	(2.43)	(6.43)	(12.82)	(21.91)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/Loss for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(2.05)	2.55	(2.43)	(6.43)	(12.82)	(21.91)
6	Equity Share Capital, (face value of Rs.10 each)	59.75	59.75	59.75	59.75	59.75	59.75
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous				(151.75)	(117.89)	(145.32)
8	Earning Per Share (before extraordinary items) of Rs.10 /- each	(0.34)	0.43	(0.41)	(1.08)	(2.15)	(3.67)
	Basic Diluted	(0.34)	0.43	(0.41)	(1.08)	(2.15)	(3.67)
9	Earning Per Share (after extraordinary items) of Rs.10 /- each	(0.34)	0.43	(0.41)	(1.08)	(2.15)	(3.67)
	Basic Diluted	(0.34)	0.43	(0.41)	(1.08)	(2.15)	(3.67)

Notes :  
1. The above Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 28th January, 2025. The statutory auditors have carried out a limited review of the results for the quarter ended December 31, 2024 and have expressed an unqualified audit opinion.  
2. The figures for the previous period/year have been regrouped/reclassified, wherever necessary.  
3. This Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.  
4. The Disclosure is as per Regulation 33 of SEBI (Listing Obligations & Disclosures Requirements) Regulations, 2015.  
5. The Company is operating in single segment, so above results are for single segment only.

For and on behalf of the Board of Directors  
For, Shah Foods Limited  
Sd/-  
HEMAKSHI MANAN PATEL  
Director  
DIN : 07297442

Place : Ahmedabad  
Date : 28-01-2025